

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ-ગાંધીનગર  
અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની અગત્યની જાહેરાત

મંડળની જા.ક. ૧૨૪/૨૦૧૬૧૭ જુનિયર ઇન્સ્પેક્ટર સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ એમ બંને પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ સંયુક્ત ગુણના મેરીટ્સ તેમજ કેટેગરીવાઈઝ ભરવાની થતી જગ્યાના આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરી, યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી તા.૨૬/૧૧/૨૦૧૮ અને તા. ૨૭/૧૧/૨૦૧૮ ના રોજ કરવામાં આવેલ હતી.

ઉક્ત ચકાસણીમાં કેટલાક ઉમેદવારો ગેર-હાજર રહેતા અને કેટલાક ઉમેદવારો ગેર-લાયક ઠરતાં પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર કેટલાક વધુ સંભવિત ઉમેદવારોની અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવી જરૂરી બનતાં ઉક્ત જાહેરાત/સંવર્ગની યાદીમાં નીચે દર્શાવ્યા મુજબના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી મંડળની કચેરી ખાતે તા. ૨૩/૦૧/૨૦૧૯ ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે રાખેલ છે. આ ઉમેદવારોના અસલ પ્રમાણ પત્રોની ચકાસણી માટે મંડળ તરફથી ટેલિફોનિક સૂચના મળેથી સુચનાનુસારની તારીખ/સમયે મંડળની કચેરી ખાતે ઉમેદવારોએ પોતાની જાતિ, વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત વગેરેને લગતા અસલ પ્રમાણપત્રો તેમજ તેની બે ઝેરોક્ષ નકલો (પ્રમાણિત/ સ્વપ્રમાણિત) અને એક પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે લાવવાનો રહેશે.

જે ઉમેદવાર ઉપર વર્ણવેલ નિયત તારીખે અને સમયે પ્રમાણપત્રોની ચકાસણી માટે ઉપસ્થિત નહીં રહે તો તેવા ઉમેદવારને નોકરીની જરૂરિયાત નથી તેમ માનીને મંડળ દ્વારા તેઓને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર આગળની ભરતી પ્રક્રિયામાંથી પડતા મુકવામાં આવશે. તેમજ તેવા ઉમેદવાર ઉક્ત બંને કસોટી- સ્પર્ધાત્મક લેખિત કસોટી તથા કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી કસોટીમાં મેળવેલ ગુણના મેરીટ્સ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન મેળવવાપાત્ર હશે તો પણ તેઓનો તે હક્ક આપોઆપ રદ થયેલ ગણવામાં આવશે અને તે સામેની તેઓની કોઈ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. જેની જરૂરી નોંધ લેવા પણ જણાવવામાં આવે છે.

| <b>LIST OF CANDIDATES CALLED FOR DOCUMENT VERIFICATION (Second Round)</b>           |                              |                                   |                                   |               |
|---|------------------------------|-----------------------------------|-----------------------------------|---------------|
| <b>FOR THE POST OF JUNIOR INSPECTOR (ADVT. NO. 124/201617 )</b>                     |                              |                                   |                                   |               |
| <b>VERIFICATION of AGE, QUALIFICATION, CASTE AND ALL OTHER ELIGIBILITY CRITERIA</b> |                              |                                   |                                   |               |
| <b>Sr. No.</b>  | <b>Roll No. Written Exam</b> | <b>Roll No. Comp. Profi. Exam</b> | <b>Name</b>                       | <b>Gender</b> |
| <b>1</b>  | <b>124008059</b>             | <b>124000052</b>                  | <b>ABHIPSHA MAYURKUMAR DAVE</b>   | <b>F</b>      |
| <b>2</b>  | <b>124023163</b>             | <b>124000167</b>                  | <b>HINAXIBEN ASHOKKUMAR PATEL</b> | <b>F</b>      |

નોંધ:- પ્રથમ તબક્કાની ચકાસણીમાં કેટલાક ઉમેદવારો ગેરહાજર / ગેરલાયક ઠરતાં પસંદગી/ પ્રતિક્ષા યાદી માટે પૂરતા લાયક ઉમેદવારો ઉપલબ્ધ ન થતાં બીજા તબક્કામાં અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે જૂરિયાત કરતાં કેટલાક વધારે ઉમેદવારોને બોલાવવામાં આવેલ છે. તેથી પ્રમાણપત્રોની ચકાસણીને અંતે લાયક ઠરેલ તમામ ઉમેદવારોનો સમાવેશ પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં થઈ જ જશે તેવું માની લેવાનું રહેશે નહીં. અને તેથી ઉપર દર્શાવેલ યાદીમાં પોતાના નામના સમાવેશ માત્રથી કોઈ ઉમેદવાર તેઓનો પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવેશ માટેનો કોઈ હક્ક દાવો કરી શકશે નહીં.

સ્થળ: ગાંધીનગર

તા. ૨૨/૦૧/૨૦૧૯

સચિવ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

ગાંધીનગર